

RAN-1901000601020001

M.A. (External) (Part-1) Examination March - 2026 Economics (Paper - II) - Macro Economics

Time: 3 Hours]

[Total Marks: 100

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) દરેક પ્રશ્નના ગુણ સમાન છે. Each question carry equal marks.	Seat No.: Student's Signature
--	--

- પ્ર. 1. રાષ્ટ્રીય આવકનો ત્રિ-ક્ષેત્રીય પ્રવાહ આકૃતિની મદદથી સમજાવો. 20
અથવા
- પ્ર. 1. મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો ખ્યાલ વિગતે સમજાવી; મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો.
- પ્ર. 2. નાણાંની માંગ અંગે પ્રો. ફીશરનું સમીકરણ સમજાવો. 20
અથવા
- પ્ર. 2. (અ) નાણાંના પુરવઠા અંગે RBI નો અભિગમ સમજાવો. 10
 (બ) કાયમી આવકનો ખ્યાલ ચર્ચો 10
- પ્ર. 3. રોકડ પસંદગીનો સિદ્ધાંત સવિસ્તાર સમજાવો. 20
અથવા
- પ્ર. 3. (અ) નાણાંની માંગના હેતુઓ 10
 (બ) નાણાંની માંગનું કેમ્બ્રિજ સમીકરણ 10
- પ્ર. 4. IS-LM મોડેલની સવિસ્તર સમજૂતી આપો. 20
અથવા
- પ્ર. 4. વેપાર ચક્રનો વાસ્તવિક સિદ્ધાંત સમજાવો.
- પ્ર. 5. (અ) દ્વિ ક્ષેત્રીય અર્થતંત્રમાં આવકનો ચક્રીય પ્રવાહ 10
 (બ) નાણાં પુરવઠાનું નિયમન 10
અથવા
- પ્ર. 5. (અ) સામાજિક હિસાબી પદ્ધતિના સ્વરૂપો 10
 (બ) મૂડીની સીમાંત કાર્યક્ષમતા, મૂડી રોકાણ અને વ્યાજનો દર 10

ENGLISH VERSION

- Q. 1. Explain the three sector flow of national with the help of diagram. 20
OR
- Q. 1. Explain the meaning of marginal efficiency of capital; discuss the factors affecting marginal efficiency of capital.

Q. 2.	Explain the equation of demand for money by Prof. Fisher.	20
	OR	
Q. 2.(A)	Explain RBI's approach to money supply.	10
(B)	Discuss the concept of permanent income	10
Q. 3.	Explain in detail the principle of liquidity preference.	20
	OR	
Q. 3.(A)	Objectives for demand for money	10
(B)	Cambridge equation of demand for money	10
Q. 4.	Give a detailed explanation of IS-LM model.	20
	OR	
Q. 4.	Explain the real theory of business cycles.	20
Q. 5.(A)	Cyclical flow of income in a two sector economy	10
(B)	Control of money supply	10
	OR	
Q. 5.(A)	Nature of social accounting method	10
(B)	Marginal efficiency of capital, investment and interest rate	10
